

## આયતુલ્લાહ અલ ઉમ્મા શેખ બશીરહુસૈન નજ્દીના સુચનો

- તે લોકો કે જેઓ ઇમામ હુસૈન(અ.સ.)ની સેવા કરવા ઇચ્છે છે, તેઓ એ ખાલીસ દિલથી અલ્લાહની કુરબત હાસિલ કરવા માટે સેવા કરવી જોઈએ.
- પોતાની નમાઝોને સમયસર પઢે કારણ કે ઇમામ હુસૈન(અ.સ.)એ પોતાની કુરબાની આ માટે જ આપી છે અને વાજીબ કામોને મુસ્તહબ કામો પર પ્રાથમિકતા આપે.
- દુઃખ અને ગમનો માહોલ બનાવે અને હસવું અથવા પોતાના દાત દેખાય તે રીતે મુસ્કુરાવવું નહીં.
- પોતાની સફર દરમીયાન “સુબહાનઅલ્લાહ, લા એલાહુ ઇલ્લલ્લાહ અને અલ્લાહો અકબર” પઢતા રહે. આ સૌથી બેહતરીન ઝિક્ર છે. “તો તમારા પોતના માટે (આખેરત)ની જોગવાઈ કરો. ખરેખર આ જોગવાઈ પોતાની રક્ષા માટે છે” (સુ. બકરહુ:૧૮૭), જેવી રીતે કુરઆન, દુઆ અને ઝિયારત.
- ખાવા-પીવાની સામગ્રી વેડફે નહીં. કાફલના સરપરસ્ત તેનું ધ્યાન રાખે અને મુસાફરોએ પાણી આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
- આ પવિત્ર શહેરની સાર્વજનિક જગ્યાની સફાઈનો ખયાલ રાખે.
- ઇમામ અલ-મહદી(અ.ત.ફ.શ.)ની તરફથી ઝિયારત પઢવાનું યાદ રાખે અને આપ(અ.ત.ફ.શ.)ના જલ્દી ઝુહુર માટે દુઆ કરે.

### અગત્યના સંપર્ક નંબરો :

ઇમરજન્સી પરિસ્થિતી માટે	૧૦૪
ખોવાયેલ વ્યક્તિ માટે	૦૭૮૦ ૧૩ ૦૦ ૫૬૧
દીની (ધાર્મિક) પ્રશ્ન માટે	૦૭૮૧ ૪૬ ૫૧ ૩૫૩
કાર્યાલય કેન્દ્ર	૦૭૮૦ ૧૦ ૦૪ ૭૫૮

ઇમામ હુસૈન(અ.સ.) સુધી ચાલીને જવાનો પ્રયાસ એક કરવા લાયક અનુભવ છે.

વધુ માહિતી માટે :

[www.walktokarbala.com](http://www.walktokarbala.com)

[www.facebook.com/walktokarbala](http://www.facebook.com/walktokarbala)

આયતુલ્લાહ શેખ બશીરહુસૈન નજ્દીની નીગરાનીમાં ચાલતો પ્રોજેક્ટ

મહેરબાની કરીને આ માહિતી પ્રત્રીકાનો ખયાલ રાખે કારણ કે આમા અલ્લાહ અને અઈમ્મમા(અ.મુ.સ.)ના નામો છે.

હઝરત ઇમામ જાફરે સાદિક(અ.સ.)એ ફરમાવ્યું:

અગર અમારો કોઈ શિયા ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત માટે જાય છે, તો તેના પાછા ફરવાના સમય સુધીમાં તેના દરેક ગુનાહ માફ કરવામાં આવે છે. તેના અથવા તેની સવારીના દરેક કદમ જે ઝિયારત તરફ લઈ જાય છે, તેના માટે ૧૦૦૦ સવાબ લખવામાં આવે છે, તેના ૧૦૦૦ ગુનાહ માફ કરવામાં આવે છે અને તેના ૧૦૦૦ દરજ્જા બુલંદ કરવામાં આવે છે.

(બેહારુલ અન્વાર, ભાગ: ૧૦૧, પેજ નં. ૨૫, હદીસ: ૨૬)

# ઇમામ હુસૈન

(તેમના પર દુરુદો સલામ થાય)

ની ઝિયારત માટે ચાલીને જવાવાળાઓ માટે એક માહિતી સભર પુસ્તીકા

લાખો લોકો ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત માટે કરબલા તરફ ચાલીને જઈ રહ્યા છે. શું આપ તેઓમાં શામિલ થવા ઇચ્છો છો? આપ નજફથી કરબલા સુધીની આ મહત્વપૂર્ણ સફરમાં કેવી રીતે શામિલ થઈ શકો છો તે સમજવા માટે વાંચો...

## અંદાજીત સફર :

- કુલ અંતર : ૮૦ કી. મીટર
- કુલ પોલ : ૧૪૫૨
- બે પોલ વચ્ચેનું અંતર : ૫૦ મીટર (૨૦ પોલ = ૧ કી. મીટર)
- અંદાજીત ચાલવાનો સમય : ૨૦ થી ૨૫ કલાક
- અંદાજીત ચાલવાના દિવસ : ૨ થી ૩ દિવસ
- સફર શરૂ કરવાનો યોગ્ય સમય : ૧૬ સફર
- સફર પુરી કરવાનો અંદાજીત સમય : ૧૮ સફર
- કોણ મુસાફરી કરી શકે છે? : દરેક (પુરૂષ/સ્ત્રી/બાળકો/પરિવાર સાથે)

## સુચના

ઈમામ અલી(અ.સ.)ના રોજાનો દરવાજો બાબુલ સા'આ (ઘડીયાળી દરવાજા)થી બહાર નીકળીને ઈમામ ઝૈનુલ આબેદીન(અ.સ.) રોડ અથવા ઈમામ જાફર સાદિક(અ.સ.) રોડ પર સીધા ચાલવાનું શરૂ કરે. આ રસ્તો આપને સીધો રાજમાર્ગ/હાઈ-વે પર લઈ જશે. ત્યાંથી આપ જમણી બાજુ વળો, તમને કરબલા ચાલીને જવાવાળા હજારો લોકો મળશે. આ તે લોકોના ગૃપ સાથે ચાલવાનું ચાલુ કરો, જે આપને લગભગ ૭૫ કી. મીટરના અંતર પછી પોલ નંબર ૧૪૫૨, હઝરત અબ્બાસ(અ.સ.)ના રોજા સુધી પહોંચાડી દેશે.

## ચાલીને જવાનો સમય/રીતને લગતા મુદ્દાઓ:

- ફઝ પછી ચાલવાનું ચાલુ કરે અને મગરીબ પછી આરામ કરે.
- પહેલી રાત હુસૈની કેમ્પ પોલ નં. ૫૦૦ આસ-પાસ અને બીજી રાત હુસૈની કેમ્પ પોલ નં. ૧૦૦૦ આસ-પાસ પસાર કરે.
- અંદાજે ૧૦૦ પોલનું અંતર પસાર કરીને ૫ પી ૧૦ મીનીટ આરામ કરે અને ફરી પોતાના પરિવાર, દોસ્તો અથવા ગૃપની સાથે થઈ જાય.
- મુસાફરી દરમીયાન પોતાને વધુ તકલીફમાં ન મુકે અને જરૂરીયાત મુજબ આરામ જરૂર કરે.
- મગરીબના સમયે પોતાના સુવા માટે કોઈ એક હુસૈની કેમ્પમાં જગ્યા મેળવી લે, જે ત્યાં વધારે સંખ્યામાં છે અને તમને કોઈ જાતની ચીંતા ન હોવી જોઈએ.
- ભીડમાં ખોવાયેલા લોકોને ગોતવા માટે પોલ નં. ૭૨, ૩૩૫, ૬૦૨, ૧૧૦૩ અને હઝરત અબ્બાસ(અ.સ.)ના રોજા પર ખાસ જગ્યા છે. દરેક ૩ કી. મીટરે રીપોર્ટીંગ કેન્દ્ર છે.

## પોતાની સાથે શું સામાન લઈ જાય?

- કોશિશ કરે કે પોતાની સાથે સામાનનો વધારે ભાર ન હોય, ખાવા-પીવાની કોઈ સામગ્રી ન લે કારણકે રસ્તામાં તે વધારે પ્રમાણમાં મળી રહે છે.
  - ૨ થી ૩ દિસ માટેની પોતાની જરૂરી દવા લે. રસ્તામાં વધારે પ્રમાણમાં કલીનીક અને મેડીકલ હોય છે.
  - હાથમાં રાખવાના બેગ અને સ્ત્રીઓ પર્સના બદલે કમરમાં રાખવાના બેગ લે.
  - ઠંડીથી બચવા માટે ગરમ કપડા જેમ કે, હાથના મોઝા, પગના મોઝા, ટોપી, જેકેટ અને કાન ઢાંકવા માટેના કપડા જરૂર લે.
  - અગર આપને ચેહરા પર ખંજવાળ આવતી હોય તો તેનું ક્રિમ જરૂર સાથે રાખે.
  - પોકેટ સાઈઝ કુરઆન, દુઆ, ઝિયારતની કિતાબ રાખે, અગર મોબાઈલમાં આ વસ્તુઓ ડાઉનલોડ કરેલી હશે તો સાફ રહેશે જેથી તમે ચાલતી વખતે સાંભળી શકો અને પઢી શકો.
  - નવા અને વજનદાર પગરખા (શુઝ)ની જગ્યાએ હળવા, જુના અને આરામ દાયક શુઝ પહેરે.
  - પાસપોર્ટ, મોબાઈલ અને ચાર્જર સાથે રાખે.
- ## મહત્વના મુદ્દાઓ :
- દરેક સુવિધાઓ જેમ કે, રોકાવવું, ખાવું-પીવું અને જરૂર લાગે તો માલીશ કરાવવું મફતમાં છે. તમારે વધારે પૈસા સાથે રાખવાની જરૂર નથી સિવાય કે આપ હુસૈની કેમ્પમાં દાન કરવા ઇચ્છો.
  - બાથરૂમ-ટોઈલેટ રસ્તામાં દરેક જગ્યાએ મળશે અને કેમ્પમાં વેસ્ટર્ન (ઈંગ્લીશ) ટોઈલેટ પણ મળશે.
  - આપ અંતર પુરૂ થવાની ચીંતા ન કરો. અગર તમને સફર દરમીયાન એવું લાગે કે તમે ચાલી નહીં શકો તો આપ ત્યાં હાજર રહેલી વેન, કાર, બસ વિગેરેમાં કરબલા જઈ શકો છો જે ત્યાં હજારોની સંખ્યામાં હોય છે.
  - ૧૦ વર્ષથી વધારેનો એક સામાન્ય માણસ ૯૯.૯૯% સફરના ત્રીજા દિવસે કોઈ પણ તકલીફ વગર સફર પુરી કરી શકે છે.
  - કરબલામાં પોતાની હોટલનું નામ અને એડ્રેસ સાથે રાખે.
  - અગર તમે ફોન કરવા ઇચ્છતા હો તો, ફઝથી પહેલા કરો કારણ કે દિવસના સમયે નેટર્વ વધારે પ્રમાણમાં વ્યસ્ત હોય છે.